

કપાસની પોકેટ માર્ગદર્શિકા



કપાસના પાકમાં પોષક તત્વોના કાર્યો,
ઉણપના ચિનહો અને નિયંત્રણના ઉપાયો



કપાસ સંશોધન કેન્દ્ર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીલાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧



- ◆ કપાસમાં ફ્રિપ અને મત્થીંગ
- ◆ કૃષિ વિસ્તરણ પ્રકાશન શ્રેષ્ઠી નં. ૩-૧-૪૮
- ◆ પ્રકાશન વર્ષ - ૨૦૧૬-૧૭ (પ્રથમ આવૃત્તિ)
- ◆ નકલ - ૨૦૦૦ નંગા

- ◆ સંપાદક
- ડૉ. એલ. કે. ઘડુક, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ)
- ડૉ. વી. વી. રાજાણી, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ પેથોલોજી)
- ડૉ. જી. કે. કાતરીયા, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ફિઝીયોલોજી)
- ડૉ. એમ. જી. વળુ, સહ સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ભ્રીડીંગ)
- પ્રો. આર. કે. વેકરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- પ્રો. વી. એલ. કિકાણી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એશ્રોનોમી)
- પ્રો. એમ. વી. વરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- શ્રી એ. આર. પટેલ, ખેતીવાડી અધિકારી
- કુ. કોમલ ડી. પટેલ, ખેતીવાડી અધિકારી

- ◆ મુદ્રક
- જ્યા ઓફસેટ, જૂનાગઢ.

પોષક તત્ત્વો શું છે ?

છોડની સંતોષકારક વૃદ્ધિ અને જીવનક્રમ સફળતાપૂર્વક પૂણી કરવા માટે મુખ્ય, ગૈંગ તથા સુક્ષમ રાસાયણિક તત્ત્વોની જરૂરી પડે છે. બધા જ ઘટકો વજા ઓછી માત્રાકમાં આવશ્યક છે. પોષકતત્ત્વો એ વનસ્પતિનો મૂળભૂત ખોરાક છે. છોડને કુલ ૧૬ પોષકતત્ત્વો જરૂરત રહેણે નીચે મુજબ છે.

છોડને કચા કચા પોષકતત્ત્વોની જરૂરીયાત રહેતી હોય છે?

છોડને કુલ ૧૬ પોષકતત્ત્વો જરૂરત રહેણે જે નીચે મુજબ છે.

- (૧) કાર્બન (C), હાઇડ્રોજન (H) અને ઓક્સિજન (O) : આ ત્રણ તત્ત્વો હવા તથા પાણીમાંથી મળી રહે છે. તેથી ખાતરો દ્વારા આપવાની ભલામણ થતી નથી.
- (૨) નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P) અને પોટેશીયમ (K) : આ ત્રણ તત્ત્વો મુખ્ય પોષકતત્ત્વો તરીકે ઓળખાય છે.
- (૩) ગંધક (S), કેલ્શીયમ (Ca) અને મેનેશીયમ (Mg) : આ ત્રણ તત્ત્વો પણ મુખ્ય પોષકતત્ત્વો તરીકે ઓળખાય છે.
- (૪) તાંબુ (Cu), જસ્ત (Zn), લોહ (Fe), બોરોન (B), મોલીઝેનમ (Mo) અને કલોરીન (Cl) : આ સાત તત્ત્વો સુક્ષમતત્ત્વો તરીકે ઓળખાય છે.

કચા કારણોસર જમીનમાં પોષકતત્વોની ઉણાપ થાય છે ?

જમીનમાં પોષકતત્વોની ઉણાપ થવાના કારણો વિશે જોઈએ તો મુખ્યત્વે ઘનિષ્ઠ જેતી પદ્ધતિઓના કારણો જુદા જુદા પાકો દ્વારા વિપૂલ પ્રમાણમાં પોષકતત્વોનો ઉપાડ થવાની સાથે સાથે જુદા જુદા નિંદામણો દ્વારા પણ ઉપાડ થવાથી, અમુક પોષકતત્વો નિતાર દ્વારા વ્યય થવાથી તેમજ જમીનના ધોવાણને લીધે અમુક પોષકતત્વો વાયુરૂપે ઉડી જવાથી જમીનમાં પોષકતત્વોની ઉણાપ વર્તાયેલ છે.

ગુજરાતના કચા વિસ્તારની જમીનોમાં મુખ્ય, ગૌણ તેમજ સુક્ષ્મ તત્વોની કેટલી ઉણાપ છે ?

મુખ્ય તત્વોમાં ખાસ કરીને નાઈટ્રોજનની અછતવાળો વિસ્તાર ગુજરાતની જમીનોમાં સરેરાશ ૭૨ ટકા જેટલો છે. ફોસ્ફરસ અને પોટાશની ખાભીવાળો વિસ્તાર અનુક્રમે ૩૬ અને ૨૦ ટકા જેટલો થવા જાય છે. ગૌણતત્વોમાં ગંધકની ઉણાપવાળો વિસ્તાર સરેરાશ ૪૦ ટકા જેટલો છે. સૌરાષ્ટ્રની જમીનોમાં ગંધકની ઉણાપ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાં ૪૮ ટકા વિસ્તારમાં જસતની ઉણાપ અને ૨૮ ટકા વિસ્તારમાં લોહની ઉણાપ જણાય છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની ચૂનાયુક્ત જમીનમાં જસત અને લોહની ઉણાપ સવિશેષ જોવા મળે છે. ગુજરાતમાં મેગેનીઝ ૧૭ ટકા, તાંબુ ૧૨ ટકા, બોરોન ૫ ટકા અને મોલીઝેનમ ૧૦ ટકાની અપૂરતવાળો વિસ્તાર નોંધાયેલ છે.

જમીન કે છોડમાં પોષક તત્વોની ઉણાપ કઈ રીતે જાણી શકાય ?

જમીન કે છોડમાં પોષક તત્વોની ઉણાપ જમીન અને છોડનું રાસાયણિક પૃથ્વેકરણ કરવાથી જાણી શકાય છે અથવા છોડ ઉપરના લાક્ષણિક ચિનહો ધ્વારા જાણી શકાય છે. આ ચિનહો ઓળખવા માટે બહોળો અનુભવ તેમજ આવશ્યક તત્વોની ખાસિયતનું જ્ઞાન હોય જરૂરી છે. જેથી સાચું નિદાન થઈ શકે અને ખૂટતા તત્વોની જ પુર્તિ કરવાથી વિશેષ ફાયદો મેળવી શકાય. જમીન અને છોડમાં આવશ્યક પોષકતત્વોનું પ્રમાણ ન્યુનતમ માત્રાથી ઓછું હોય ત્યારે છોડની વૃદ્ધિ અને વિકાસ પર માઠી અસર થાય છે આ માત્રાને ક્ષાતિક માત્રા કહે છે. જે વિવિધ જમીનો માટે તેમજ જુદા જુદા પાક માટે અલગ અલગ હોવાનું માલુમ પડે છે. જમીનની ફળદૂપતા તથા ઉત્પાદકતા જાળવવવા બધાંજ જરૂરી તત્વો પ્રમાણસર જમીનમાં ઉપલબ્ધ હોવા જરૂરી છે.

પોષકતત્વોની ઉણાપના ચિનહો છોડના કચા કચા ભાગો ઉપર જોવા મળે છે ?

પોષકતત્વોની ઉણાપના લાક્ષણિક ચિનહો છોડના જુદા જુદા ભાગો ઉપર જોવા મળે છે. જેમ કે સારી રીતે વહન પામતા તત્વોના ઉણાપ ચિનહો પ્રથમ છોડના જુના નીચેના પાન ઉપર જોવા મળે છે. જ્યારે વહન ન થઈ શકે અથવા ઓછા વહન થઈ શકે તેવા તત્વોની ઉણાપના ચિનહો પ્રથમ કુમળા નવા પાન ઉપર જોવા મળે છે. દા.ત. જસત, લોહ, મેળેનીઝ, તાંબુ અને બોરોન ઓછી વહનના ઘરાવે છે. જ્યારે મોલીબ્ડેનમ મધ્યમ અને કલોરીન જેવા તત્વો નાઈટ્રોજનની

માફક સારી વહન ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને છોડના પીળા પડવાનું લક્ષણ ઘણા તત્વોની ઉષપના લીધે જોવા મળતું હોય છે. આ સંજોગોમાં છોડના કયા પાન ઉપર નીલકણોની ઉષપ વર્તાય છે અને તેથી પાન પીળા પડે છે તેને ધ્યાનમાં લેવાથી ઉષપવાળું તત્વ નક્કી કરવામાં મદદ મળે છે. દા.ત. નીચેના પાન ઉપર જોવા મળે તો તે ગંધકની ઉષપ હોઈ શકે, વળી જો ઉપરના પાનમાં આ પીળાશ માત્ર નસોની વચ્ચે હોય અને નસો લીલી માલુમ પડે તો લોહની ઉષપ હોઈ શકે.

છોડના જુદા-જુદા ભાગો ઉપર જોવા મળતા પોષ તત્વોના ઉષપના લાક્ષણિક ચિનહો :

છોડના નીચેના જુના પાન ઉપર જોવા મળતી પોષકતત્વોની ઉષપ :

નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટાશ (K), મેનેશિયમ (Mg), જસ્ત (Zn) અને મોલીબ્ડેનમ (Mo)

છોડના ટોચની કુંપળોમાં જોવા મળતી પોષક તત્વોની ઉષપ :

કેલ્લિશ્યમ (Ca) અને બોરોન (B)

છોડના નવા પાન ઉપર જોવા મળતી પોષક તત્વોની ઉષપ :

ગંધક (S), લોહ(Fe), ટાંબુ (Cu) અને મેગેનીઝ (Mn)

પોષક તત્વો છોડમાં કયા કયા કાર્યો કરે છે ?

નાઈટ્રોજન

- છોડનો ઝડપી વિકાસ કરવાનું તથા છોડના પાનને ગાઢો લીલો રંગ આપવાનું છે.
- છોડમાં તે નિયામક તરીકે કાર્ય કરે છે કારણ કે તે પોટાશ, ફોસ્ફરસ તથા બીજા તત્વોના વપરાશને નિયત્રણ કરે છે.
- નાઈટ્રોજન મૂળની વૃદ્ધિ, પ્રકાંડની વૃદ્ધિ, તેમજ પાંડડાની વૃદ્ધિ કરે છે.

ફોસ્ફરસ

- છોડમાં કોખના વિભાજનમાં તેમજ ચરબીના સંખ્યેખણમાં ફોસ્ફરસ આવશ્યક છે.
- છોડમાં ફૂલ, ફળ અને બીજબનાવવામાં મદદ કરે છે.
- મૂળનો વિકાસ સારી રીતે થાય છે. પ્રકાંડને મજબૂત બનાવી પાડને ફળતો અટકાવે છે.
- ગુણવત્તા વધારે છે.
- ફોસ્ફરસ શક્તિની હેરફેરમાં તેમજ કાર્બોહાઇડ્રેટ, ચરબી અને ઓમિનો એસિડની રસાયણની ડિયામાં તેમજ ઉપયુક્તનમાં અગત્યનો ભાગ ભજવે છે.

પોટેશ્યમ

- પ્રકાશ સંશ્લેષણની કિયામાં અને કાર્બોહાઇડ્રેટના સંશ્લેષણ માટે ખાસ જરૂરી છે.
- પોટેશ્યમ છોડની કેટલીક મહત્વની દેહધાર્મિક કિયાઓમાં અગત્યની કામગીરી બજાવે છે સાથે સાથે જુદા જુદા ઉત્સેચકોને સક્રીય કરે છે.
- કાર્બોહાઇડ્રેટનું સ્થળાંતર અને સંગ્રહ, નાઈટ્રોજનનો ઉપાડ અને પ્રોટીન સંશ્લેષણની કિયાઓમાં અગત્યનો ભાગ બજવે છે.
- છોડમાં પાણીની જાણવણી, છોડને રોગજીવાત તેમજ પાણીની અછત સામે પ્રતિકારક શક્તિ આપે છે. પાકની ઉત્પાદન ગુણવત્તામાં વધારો કરે છે.
- તેલના ટકામાં વધારો કરે છે.

કેલિશાયમ

- છોડના પાયાના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે કામ કરે છે.
- છોડના મૂળિયાઓની તેમજ છોડની વૃદ્ધિ માટે જરૂરી છે. ફૂલ બનવાની કિયામાં પણ તે ઉપયોગી છે.
- કેલિશાયમ છોડમાં પ્રોટીનની બનાવટ સાથે પણ સંકળાયેલ છે.

મેનેશિયમ

- છોડમાં નીલરસના બંધારણમાં એક માત્ર ખનિજતત્વ તરીકે આવેલું છે.

- મેળેશિયમ પ્રકાશ સંશોધણાની કિયા સાથે સંકળાયેલું છે.
- તે છોડવા ઓમાં ફોસ્ફેટની ડેરફેર અને ચયાપચય સાથે સંકળાયેલું છે.

સલ્ફર

- તે છોડમાં એમીનો એસીડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.
- દાણામાં તેલનું પ્રમાણ વધારે છે.
- પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડમાં નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.

લોઇન્ઝ

- હરિતકણાના ઉત્પાદનમાં અને પ્રકાશ સંશોધણાની કિયામાં જરૂરી છે તેમજ જુદા જુદા પ્રોટીનના સંશોધણમાં ઉપયોગી છે.
- પાકની વૃદ્ધિ અને ફ્લીનીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.
- છોડને અન્ય તત્વોના ઉપાડ કરવામાં મદદ કરે છે.

મેંગોનીઝ

- છોડમાં હરિતકણોના બંધારણમાં તેમજ નાઈટ્રોજનના ચયાપચયની કિયામાં ઉદ્દીપક તરીકે કામ કરે છે.
- છોડની જૈવરસાયણિક આંતરિક પ્રક્રિયામાં ઉપયોગી છે.

જસાટ

- વનસ્પતિના જીવરસ તેમજ ફ્લીનીકરણની પ્રક્રિયામાં ઉપયોગી છે.

- છોડના વિકાસમાં ઉત્સેચક તરીકે તેમજ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે.

તાંબુ

- છોડમાં શ્વસનક્રિયાનું નિયમન કરે છે તેમજ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે.
- પ્રોટીનના બંધારણમાં તેમજ દાણાના યોગ્ય વિકાસ માટે જરૂરી છે.

બોરોન

- પાકની વૃદ્ધિ, પ્રજનન, અને દેહધાર્મિક ક્રિયામાં ખૂબજ મહત્વનું છે.
- નાઈટ્રોજનના ઉપાડ માટે મદદરૂપ થાય છે. છોડના મૂળની વૃદ્ધિ સારી થાય છે.

કલોરીન

- પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી છે તેમજ કોખરસમાં રસાર્કર્ષણ દાબને અંકુશમાં રાખવા જરૂરી છે.
- ફીલાઈજર કન્ટ્રોલ ઓર્ડર ધ્વારા પ્રમાણિત થયેલ ખાતરોની પૂર્તિ કરવી હિતાવહ છે. જ્યારે ઉભા પાકમાં ઉણપના લક્ષણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટા તત્વની પ્રમાણસર પૂર્તિ છંટકાવથી કરવી જોઈએ. જ્યારે જમીનમાં સુશ્મતત્વોની ઉણપ હોય ત્યારે સેન્ટ્રિય ખાતરોમાં આ તત્વોનું પ્રમાણ વિશેખ હોવાથી તેની નિયમિત પૂર્તિ કરવાથી સુશ્મતત્વોની ઉણપ મહદ અંશો નિવારી શકાય છે.



घटता पोषक तत्वांची उद्भवता यिन्होनुं द्रव्यांपैषा

કપાસ-નાઈટ્રોજનની ઉણપ



ઉણપના ચિંહો:

- છોડના નીચેના જૂના પાન પીળા પડે
- છોડના મુળ નબળા અને રાતા બદામી રંગના દેખાય
- આખો છોડ આછા લીલા રંગનો જોવા મળે
- છોડ વહેલો પરિપક્વ થાય
- વિષમ પરિસ્થિતિમાં પાન બળેલ હોય તેવા દેખાય

નિયંત્રણ:

- જમીનમાં નાઈટ્રોજન યુક્ત ખાતર આપવું
- છોડ પર ૧ થી ૨ ટકા (૧૦૦ થી ૨૦૦ ગ્રા./૧૦ લી. પાણી) યુરીયાના દ્રાવણનો છંટકાવ કરવો
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/ઝે.આપવું.

કપાસ-ફોસ્ફરસની ઉણપ



ઉણપના ચિંહો:

- છોડના નીચેના જુના પાન કંસા જેવા રતાશ પડતા બદામી રંગના દેખાય અથવા પાન પર જાંબુડીયા રંગની ઝાય જોવા મળે
- છોડના પાન થડ આછા જાંબુડીયા રંગના (Purple) જોવા મળે
- પાન સાંકડા અને થડ સાથે લઘુકોણ બનાવતા ઉભા જોવા મળે
- વિષમપરિસ્થિતિમાં પાન કાળાશ પડતા રતા દેખાય અને પાનના પાછળના ભાગમાં લાલ ડાધા પડેલ જોવા મળે
- છોડના નીચેના પાન ધેરા લીલા રંગના જોવા મળે

નિયંત્રણા:

- જમીનમાં ફોસ્ફરસયુક્ત ખાતર આપવું દા.ત. સુપર ફોસ્ફેટ
- ફોસ્ફરસ દ્રાવ્ય (પીએસએમ) સુક્ષ્મ જીવાણુ (૧૦ મીલી/૧ ક્રિ.ગ્રા. બીજ) ની બીજ માવજત આપવી અથવા કપાસના પાકમાં (૩૦ મીલી/૧૦ લી. પાણી) છંટકાવ કરવો.
- જમીનમાં સેન્દ્રિય ખાતર ૧૦ ટન/ઝે.આપવું.

કપાસ-પોટસની ઉણાપ



ઉણાપના ચિનહો:

- છોડના પાનની કીનારી રતાશ કથ્થાઈ બદામી (Brown) રંગની જોવા મળે અને પાન સુકાઈ જાય તથા જૂના પાનના અગ્ર ભાગની કિનારીથી પાન સફેદ, પીળું અથવા ત્રાંભીયા ટપકાં અને પટ્ટા જોવા મળે.
- પાન પર શિરાઓ વચ્ચે સફેદ પીળા ધાઢા જોવા મળે
- નીચેના પાન કથ્થાઈ બદામી (Brown) રંગના જોવા મળે
- ટોચ અને કિનારી નીચે તરફ વળેલી જોવા મળે

નિયંત્રણા:

- જમીનમાં પોટાશ યુક્ત રાસાયણિક ખાતર આપવું દા.ત.ભુરેટ ઓફ પોટાશ આપવું.
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/હે.આપવું.

કપાસ-કેલ્શાયમની ઉણાપ



ઉણાપના ચિંહો:

- પાનની દાંડલી વળેલી જોવા મળે અને ખરી પડે
- છોડના ટોચના નવા પાન પીળા દેખાય તથા પાનની ટોચ કળી આકારની થાય અને પાનની કિનારીઓ બળેલી જોવા મળે
- ઉગતી કળી ખરી પડે છે.
- છોડ બટકો રહે.
- છોડની અગ્રકલિકાનો વિકાસ રૂધ્ઘાય છે.

નિયંત્રણા:

- જીપ્સમ પાયાનાં ખાતર તરીકે આપવુ.
- જમીનમાં સેન્દ્રિય ખાતર ૧૦ ટન/ઝે.આપવુ.

કપાસ-મેળેશિયમની ઉણાપ



ઉણાપના ચિંહો:

- છોડના નીચેના ભાગના જુના પાનની નસો વચ્ચેનો ભાગ પીળો જોવા મળે જે પાછળથી રતાશ કલરનો દેખાય તથા નસો લીલી દેખાય
- પાન વહેલા પરિપક્વ થાય તથા પાન જદ્દીથી તુટી જાય
- છોડના નીચેના પાન રતાશ પડતા જાંબુડિયા રંગના થઈ ધીમે ધીમે બદામી રંગના દેખાય

નિયંત્રણ:

- ૧ ટકા મેળેશિયમ સલ્ફેટનો (૧૦૦ ગ્રા./૧૦ લી. પાણી) છોડ પર છંટકાવ કરવો.
- મેળેશિયમ સલ્ફેટ (૨૦–૨૫ કી./લે.) પાયાનાં ખાતર તરીકે આપવું.
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/લે.આપવું.

કપાસ-ગંધકની ઉણપ



ઉણપના ચિનહે:

- છોડના બધા પાન આદ્યા લીલા રંગના જોવા મળે
- છોડના ઉપરના કુમળા પાન પીળા રંગના જોવા મળે તથા પાનની શીરાઓ પણ પીળી દેખાય
- છોડ બટકો રહે અને થડ પાતળું જોવા મળે

નિયંત્રણા:

- નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વોની પૂર્તિ ગંધક ધરાવતા રાસાયણિક ખાતરો જેવાકે એમોનીયમ સલ્ફેટ કે સીગલ સુપર ફોસ્ફેટ વડે કરવી.
- જમીન ચકાસણી રીપોર્ટ મુજબ હેકટરે ૨૦-૪૦ કિ.ગ્રા./ગંધક આપવું.
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/હે.આપવું.

કપાસ-જસ્તની ઉણાપ



ઉણાપના ચિંહો:

- છોડના ઉપરના કુમળા પાન આછા પીળા રંગના દેખાય તથા પાન પર કાટ જેવા ડાધા દેખાય
- પાનની કિનારી ઉપરની તરફ વળેલી જોવા મળે
- પાન જાડા અને બટકણા દેખાય, છોડના પાન જુમખામાં આવે
- પાન આદ્ભુ સફેદ અને તેના પર તપખીરીયા રતાશ (Rusty brown) રંગના ડાધા જોવા મળે

નિયંત્રણ:

- છોડ પર ૦.૫ ટકા જીક સલ્ફેટને (૫૦ ગ્રા. ૧૦ લિટર પાણી) ૦.૨૫ ટકા (૨૫ ગ્રા.) ચુનાના પાણીમાં ઓગાળી પાક પર છંટકાવ કરવો. અથવા
- જમીનમાં ૨૫ થી ૫૦ કી.ગ્રા./હેક્ટર જીક સલ્ફેટ આપવું.
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/હે.આપવું.

કપાસ-મેંગોનીઝની ઉણાપ



ઉણાપના ચિન્હો:

- છોડના કુમળા પાન પીળા દેખાય તથા પાનની નસો ધારી લીલી જોવા મળે અને નસો વચ્ચેનો ભાગ પીળો દેખાય
- વચ્ચેના પીળા પાન પર રતાશ પડતા તપખરીયા રંગની ભાત અને પાનની નાનામાં નાની શીરા લીલી દેખાય

નિયંત્રણાં:

- ૦.૬ ટકા મેંગોનીઝ (૬૦ ગ્ર)./૧૦ લી.પાણી) સલ્ફેટનો ૦.૩ ટકા (૩૦ ગ્રા.) ચુન્નાના નિતર્ય પાણીમાં ઓગાળીને દ્રાવજાનો છોડ પર છંટકાવ કરવો. અથવા
- જમીનમાં ૮૦ કી.ગ્રા./હેક્ટર મેંગોનીઝ સલ્ફેટ આપવ
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/હે.આપવું.

કપાસ-લોહની ઉણાપ



ઉણાપના ચિંહો:

- છોડના ઉપરના કુમળા પાન પીળાશ પડતા ફીક્કા રંગના જોવા મળે
- પાનની આંતર શીરાનો ભાગ પીળો દેખાય તથા ધોરી નસો (શીરાઓ) લીલી જોવા મળે પાન પર વિશિષ્ટ ડાઘા પડતા નથી
- વિષમ પરિસ્થિતિમાં પાનની ધાર એટલે ડિનારી તથા ટોચ બળી જાય છે અને ઘણા સંજોગોમાં પાન સફેદ જોવા મળે

નિયંત્રણ:

- છોડ પર ૧ ટકા ફેરસ સલ્ફેટને (૧૦૦ ગ્રા./૧૦ લિ. પાણી) (હીરાકસી) અને ૦.૧ ટકા સાઈટ્રીક એસીડ (૧૦ ગ્રા.) (લીબુના ફૂલ) પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા
- જમીનમાં ૧૦૦ કી.ગ્રા./હેક્ટારે ફેરસ સલ્ફેટ આપવું
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/હે.આપવું.

કપાસ-બોરોનની ઉણાપ



ઉણાપના ચિંહો:

- છોડના ઉપરના કુમળા પાન જીણા રહે છે તથા ઉગતી કળીની આજુભાજુના પાન નિલવાર્ણિ સોયા જેવા પોંચા જોવા મળે
- પાન જાડા રહે, બરછટ થાય
- પાનની ટોચ અને ઘાર બળવા લાગે
- કુપળ ખરી પડે

નિયંત્રણા:

- ઉભા પાકમાં ૦.૩% બોરીક એસીડ અથવા બોરેક્શ (૩૦ ગ્રા./૧૦ લી. પાણી) દ્રાવણનો પાક પર છંટકાવ કરવો અથવા
- જમીનમાં પ થી ૧૦ કી.ગ્રા./હેક્ટર બોરેક્શ પાયાના ખાતર તરીકે આપવું.
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/હે.આપવું

કપાસ-કોપર (તાંબુ)ની ઉણાપ



ઉણાપના ચિનણો:

- છોડના ઉપરના પાનની ટોચ સરફેદ રંગની સુકાયેલી જોવા મળે.
- આછા પીળાશ પડતા લીલા પાન દેખાય
- પાનની આંતરશીરાનો ભાગ પીળો દેખાય
- પાન ચીમળાઈને વળી ગયેલું જોવા મળે તથા પાન જહદીથી તુટી જાય અને ખરી પડે.

નિયંત્રણા:

- ૦.૪ ટકા કોપર સલ્ફેટ (૪૦ ગ્રા./ ૧૦ લી. પાણી) ને ૦.૨ (૨૦ ગ્રા.) ટકા ચૂનાના પાણીમાં ઓગાળી પાક પર છંટકાવ કરવો અથવા
- જમીનમાં પથી ૧૦ કી.ગ્રા./હેક્ટર કોપર સલ્ફેટ આપવું.
- જમીનમાં સેન્ટ્રિય ખાતર ૧૦ ટન/ઝે. આપવું

કપાસ-મોલીબેનમની ઉણપ



ઉણપના ચિંહો:

- પાનની કીનારી અંદર તરફ વળેલી જોવા મળે
- પાનનો અગ્ર ભાગ ચાખુક જેવો જોવા મળે
- પાન કોકડા વળી ગયેલું જોવા મળે
- પાન પર ભુખરા ચકમાં દેખાય અને અસરગ્રસ્ત ડાળી નીચે ગુંદરીયો ચીકણો રસ જરે.

નિયંત્રણા:

- ૦.૧ ટકા સોડીયમ મોલીબેટ (૧૦ ગ્રા./૧૦ લી. પાણી) અથવા એમોનીયમ મોલીબેટનો પાક પર છંટકાવ કરવો અથવા જમીનમાં ૧.૮ કી.ગ્રા./હેક્ટર એમોનીયમ મોલીબેટ આપવુ.

કપાસના છોડ પર જોવા મળતા પોષક તત્વોની ખામીના ચિનહોનું વર્ગીકરણ



ઉપયોગી ટેલીફોન નંબર

નામ

મોબાઇલ નં

ઉપયોગી ટેલીફોન નંબર

નામ

મોબાઇલ નં



પ્રાપ્તિસ્થાન

કપાસ સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. જૂનાગઢ.

ફોન : ૦૨૮૫-૨૬૭૪૧૫૦